


(વર્ષ : ૨૦૨૧-૨૨)

અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ

સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ



માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
કલમ નંબર ૪ (૧) અન્વયે

પ્રો-એક્ટિવ ડીસ્કલોગર (સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ વિભાગ)

લાઈટ ખાતું, “સી” -બ્લોક, ૫ મો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ -૩૮૦ ૦૦૧
ફોન નંબર : ૩૨૫૨૦૮૨૩

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-

લાઈટ(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ) વિભાગનાં ટેકનીકલ સ્ટાફ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.


સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટ મારફતે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વિસ્તારમાં હ્યાત સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઇનટેનાન્સ ઉપરાંત સક્રમ સત્તાની મંજુરી મુજબ નવા સ્ટ્રીટલાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કામગીરી ઉપરાંત હાઈમાસ્ટ લાઈટ સુવિધા ઈન્સ્ટોલેશન, ઓપરેશન અને મેઇનટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ) વિભાગનાં એનજર્ઝ એફીશીયન્સી સેલ દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનના એનજર્ઝ કન્જવિશન બાબતની કામગીરી પણ કરવામાં આવે છે.

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	સંપર્ક નંબર
૧	શ્રી એમ.યુ. પાવાગઢી	I/C એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (સ્ટ્રીટલાઈટ)	M -૯૮૨૭૦૩૮૭૮૧ O -૦૭૯૨૫૩૮૧૮૩૨
૨	શ્રી ખાલી જગ્યા	ડ.સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રિકલ-૧)	M - ----- O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૩	શ્રી એમ.યુ. પાવાગઢી	ડ. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રિકલ-૩)	M -૯૮૨૭૦૩૮૭૮૧ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૪	શ્રી નરસિંહભાઈ એન.ગામેતી	ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટ)	O -૦૭૯૨૫૩૮૧૮૧૧

Organization Chart – Streetlight/Project Department

Year : 2024-22



(૨) અધિકારીઓ અને કર્મચારીઓનાં કાર્યો તથા ફરજો :

ક્રમ	જગાનું નામ	અધિકારી/કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	I/C એડી. ચીફ એન્જનીયર (સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)	એસઆરએફીસીઅલ તેમજ અન્ય પ્રોજેક્ટ, સ્ટ્રીટલાઈટ તથા નવા પ્રોજેક્ટની કામગીરી
૨	ડે. સીટી ઈજનેર	<p>દરેક ઝોનમાં વિભિન્ન કરી સ્ટ્રીટલાઈટના મરામત નિભાવના કામગીરીની સમીક્ષા કરવી.</p> <p>સ્ટ્રીટલાઈટના મરામત નિભાવનાં કોન્ટ્રાક્ટર ટેન્ડર મુજબ સ્ટાફ તથા કામગીરી થાય ત મુજબ ધ્યાન રાખવું.</p> <p>ઓગ્મેન્ટેશન કરવાની જરૂરિયાત છે કે કેમ તેની ટેકનીકલ ચકાસણી કરી યોગ્ય વહીવટી કામગીરી કરાવવી.</p> <p>કેપીટલ કામ તથા રેવન્યુ કામના ટેન્ડર સમયસર કરવા.</p> <p>અકસ્ત્રા આઈટમ થતી હોઈ તો તેની ચકાસણી, અન્ય વિકલ્પ, સક્ષમ સત્તાની મંજુરીની કામગીરી.</p> <p>સ્ટાફની વ્યવસ્થા</p> <p>એ.એમ.સી. દ્વારા ઉજવવામાં આવતાં તહેવારો તથા હેરીટેજ વિક દરમ્યાન હેરીટેજ ડેક્યુમેન્ટ્સ, એ.એમ.સી. બીલીગને ટેમ્પરરી લાઈટીંગથી રોશની કરવા તેમજ સરકારી કાર્યક્રમ દરમ્યાન ટેમ્પરરી લાઈટીંગની કામગીરી (એ.એમ.સી. દ્વારા કરવાના થતા કામો)</p> <p>બજેટને લગતી કામગીરી</p> <p>પ્રોજેક્ટનું મોનીટરીંગ સમયસર પૂર્ણ થાય તે અંગે કામગીરે કવોલીટી તથા મેજરમેન્ટની ચકાસણી</p> <p>જોન હેઠળના સ્ટ્રીટલાઈટના સ્ટાફની કામગીરી પર દેખરેખ અને પરફોર્માન્સ ઈવેલ્યુઅશન</p> <p>આર.ટી.આઈ., એમ.પી., એમ.એલ.એ., સરકારશ્રીમાંથી આવતાં સ્ટ્રીટલાઈટની કામગીરીને લગતાં પ્રશ્નો સમયસર જવાબ કરવા વિભાગની વહીવટી કામગીરી</p>
૩	આસી.સીટી ઈજનેર	<p>અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્ટ્રીટલાઈટ બંધના રહે તેનું ધ્યાન રાખવું તથા થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું.</p> <p>સ્ટ્રીટલાઈટ ચાલુ કંડીશનમાં રાખવા તથા ૧૦૦% સ્ટ્રીટલાઈટો ચાલુ રહે તે સુનિશ્ચિત કરવું.</p> <p>પ્રીવેન્ટીલ મેઇનન્ટેનાન્સ સમયસર થાય તેનું ખાનીંગ કરવું.</p> <p>ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટર રીપેરીંગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીંગ કરવું.</p> <p>પ્રોજેક્ટના કામના ઓગ્મેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીઝિકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી.</p>

		<p>કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોર્ડિંગ, મેઝરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી.,</p> <p>અનજીબીલનું દર માસે સુટીની કરવું તથા અનજી વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદે પગલાં લેવાં.</p> <p>જોનલ એક્ટીવીટી, નવા ખોલવામાં આવતાં ટીપી રોડ પર સ્થળતપાસ કરી સ્ટ્રીટલાઈટની જરૂરીયાત મુજબ એસ્ટીમેટ બનાવી સક્ષમ સત્તાની મંજુરી મેળવવી.</p>
૪	આસી.ઇજનેર	<p>સ્ટ્રીટલાઈટ બંધના રહે તેનું ધ્યાન રાખવું.</p> <p>બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું.</p> <p>પ્રીવેન્ટીવ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાનીંગ કરવું.</p> <p>કોન્ટ્રાક્ટ ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીંગ કરવું.</p> <p>ટેન્ડરમાં કેપીટલ/રેવન્યુ કામના એમ.બી. રેકોર્ડિંગ કરવું તેમજ મેઝરમેન્ટ ચેક કરવું.</p> <p>પ્રોજેક્ટ/ઓંમેન્ટેશનના કામમાં ઈરેક્શન સમયે ટેકનીકલ ચકાસણી કરવી.</p> <p>સ્ટાફ સંબંધી વહીવટી કામગીરી કરવી.</p> <p>અનજી એક્શન્સીયન્સીને લગતી કામગીરી.</p> <p>અનજી બીલનું દર માસે સુટીની કરવું તથા અનજી વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદે પગલાં લેવાં.</p> <p>જોનલ એક્ટીવીટી, હાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમસી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફ્ડીસીએલની કામગીરી</p>
૫	ટેક.સુપરવાઈઝર	લેખિત રીપોર્ટ એ.ઇ./એ.સી.ઇ.ને દરરોજ આપવા, ડાયરી મેઈન્ટેઇન કરવી, કોઈપણ પ્રોભ્લેમ હોય તો એ.ઇ./એ.સી.ઇ. અથવા ટે.સી.ઇ.ને જાણ કરવી.
૬	આસી.ટેકનીકલ સુપરવાઈઝર	
૭	સ્ટ્રીટલાઈટ ઈસ્પે.	સ્ટ્રીટલાઈટ બંધ ન રહે તેનું ધ્યાન રાખવું તથા સમયસર જરૂરીયાત મુજબની કામગીરી કરાવવી.
૮	આસી. મેનેજર	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી કરવાની તથા વહીવટી કાર્ય આનુષ્ઠાનિક તમામ વહીવટી કામગીરી
૯	ઓફિસ સુપ્રીટેન્નટ	આસી.મેનેજરશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી
૧૦	એકાઉન્ટન્ટ	ખાતાની નાણાંકીય તમામ કામગીરીનું સંચાલન
૧૧	હેડ કલાર્ક	ઓફિસ સુપ્રી.ની સુચના અનુસાર વહીવટી કામગીરી
૧૨	સીની. કલાર્ક	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઈભેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઈએમડી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૩	જુની.કલાર્ક	બજેટ બુક, ઠરાવ, બીલ કલાર્ક, રીએમ્બસમેન્ટ, સર્વિસ બુક મેઈન્ટેનન્સ,

		કર્મચારી/અધિકારી નિવૃત્તિ તથા સ્વ.નિવૃત્તિની કામગીરી, પોસ્ટેજ, આઈટવર્ક-ઇનવર્ક ની કામગીરી.
	પટાવાળા	ઇનહોર પટાવાળા - ખાતાકીય પટાવાળા તરીકેની કામગીરી આઉટહોર પટાવાળા - બહારના ખાતાને લગતી ટપાલો આપવા જવાની કામગીરી, તથા ખાતાકીય પત્રો પોસ્ટેજની કામગીરી

- (૩) દેખરેખ અને જવાબદારનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસારની માહિતી :
ખાતાની કામગીરીનાં અનુસંધાને જે તે સક્ષમ સત્તાની મંજુરી મેળવીને નિર્ણય લેવામાં આવે છે.
- (૪) પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો :
જે તે કામગીરી માટે સક્ષમ સત્તાની જરૂરી મંજુરી મુજબ તુમાર અને ફાઈલોનો નિકાલ કરવામાં આવે છે.
- (૫) પોતાનાં કાર્યો બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાનાં નિયંત્રણ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ :
અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશનનાં નીતિ-નિયમો તથા બોમ્બે પ્રોવિન્સીયલ ભૂનિસિપલ એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાનાં નિયંત્રણ હેઠળ હોય તેવાં દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૭) તેની નિતી અથવા તેનાં અમલીકરણનાં ઘડતર સંબંધમાં જનતાનાં સત્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન ગોઠવણીની વિગતો :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેનાં ભાગ તરીકે અથવા તેની સલાહમાં હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનાં બનેલાં બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ અને બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેનાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :
અમદાવાદ ભૂનિસપલ કોર્પોરેશન મારફતે દર વર્ષે બહાર પાડવામાં આવતી ડાયરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સદર ડાયરીની

સોફ્ટકોપી અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.org પર મુકવામાં આવે છે. જેમાં દર વર્ષે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવતી ડાયરીમાં અગત્યનાં ટેલીફોન નંબરોનો સમાવેશ કરવામાં આવે છે.

(૧૦) તેનાં વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેનાં દરેક અધિકારીઓ અને મળતાં માસિક વળતર :

ક્રમ	હોદ્દો	પે મેટ્રીક્સ
૧	એ.ડી. સી.ઈ.	૧૧૮૫૦૦ - ૨૧૪૧૦૦
૨	ડે.સી.ઈ.	૬૭૭૦૦ - ૨૦૮૭૦૦
૩	આ.સી.ઈ.	૫૩૧૦૦ - ૧૬૭૮૦૦
૪	આસી.ઇજનેર	૪૪૬૦૦ - ૧૪૨૪૦૦
૫	ટેક.સુપરવાઈઝર	૨૮૨૦૦ - ૮૨૩૦૦
૬	સ્ટ્રીટલાઈટ ઈસ્પે.	૨૫૫૦૦ - ૮૧૧૦૦
૭	આસી.ટેક.સુપરવાઈઝર	૨૫૫૦૦ - ૮૧૧૦૦
૮	આસી. મેનેજર	૫૩૧૦૦ - ૧૬૭૮૦૦
૯	ઓફિસ સુપ્રીટેન્ન્ટ	૪૪૬૦૦ - ૧૪૨૪૦૦
૧૦	એકાઉન્ટન્ટ	૩૪૪૦૦ - ૧૧૨૪૦૦
૧૧	હેડ કલાર્ક	૩૪૪૦૦ - ૧૧૨૪૦૦
૧૨	સીની. કલાર્ક	૨૫૫૦૦ - ૮૧૧૦૦
૧૩	જુની. કલાર્ક	૧૬૮૦૦ - ૬૩૨૦૦
૧૪	પટાવાળા	૧૪૮૦૦ - ૪૭૧૦૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરનાં અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર : સદર માહિતી અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.org અને વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજપત્રમાં મુકવામાં આવેલ છે.

(૧૨) ફણવેલ રકમ અને એવા કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો :

સદર માહિતી અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અતેના ખાતાને લગતી માહિતી, અગત્યનાં ટેલીફોન
નંબરો તથા વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજપત્ર તથા બીજી અગત્યની માહિતી ઉપલબ્ધ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવમાં આવતાં હોય તેવા ગ્રંથપાલ અથવા તેનાં વાંચનાલયનાં કામકાજનાં
કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને બીજી વિગતો :

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	સંપર્ક નંબર
૧	શ્રી અમ.યુ.પાવાગઢી I/C એડી. ચીફ એન્જનીયર અને અપીલ અધિકારીશ્રી(સ્ટ્રીટલાઇટ/ પ્રોજેક્ટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૮૩૨૭૦૩૮૭૮૧ O -૦૭૯૨૫૩૫૧૮૩૨
૨	ખાલી જગ્યા ડે.સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક-૧)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M ----- O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૩	શ્રી અમ.યુ. પાવાગઢી ડે. સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક-૩)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૮૩૨૭૦૩૮૭૮૧ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૪	શ્રી નરસિંહભાઈ એન.ગામેતી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટ)	સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી	“બી”-બ્લોક, ચોથો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	O -૦૭૯૨૫૩૮૧૮૧૧

(૧૭) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :

નથી.

ઓનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧-૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક-પીએડી-૧૦-૨૦૦૭-૩૩૪૩૬૪-આરટીઆઈસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણ પત્ર આપવામાં આવે છે કે લાઇટ(સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ) વિભાગના જાહેર સત્તામંડળ દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ (૧) (ખ) અંતર્ગત સ્વચંમ જાહેર કરવાની બાબતો - પ્રોએક્ટિવ ડીસ્કલોગર (પીએડી) તૈયાર કરવામાં આવેલ છે.

જે તા.૦૧.૦૫.૨૦૨૧ ની સ્થિતીએ અદ્યતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા ઈન્સપેક્શન કરું અને ઓડિટ કરવામાં આવેલ છે અને જે બાબતે અપુરતી વિગતો જણાઈ હતી તેની પુર્તતા કરાવવામાં આવેલ છે.

એડી. ચીફ ઓફિસર
(સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ)

મુખ્ય મથક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
સરદાર પટેલ ભવન, સી-લ્લોક, પાંચમો માળ,
દાણાપીઠ, ખમાસા રોડ, અમદાવાદ

કચેરીનું નામ —લાઇટ(સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ) ખાતું

પ્રતિ,

જાહેર માહિતી અધિકારી અને એસેસર અને ટેક્સ કલેક્ટરશ્રી,
આર.ટી.આઈ. સેલ વિભાગ
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર
(વર્ષ ૨૦૨૧-૨૨) ની માહિતી બાબત....

શ્રીમાન,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ(સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ) ખાતાની વર્ષ
૨૦૨૧-૨૨ માટે જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર
કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે, તો સદરદું માહિતીને જાહેર માહિતી અધિનિયમ હેઠળ
આગળની આનુષંગીક કાર્યવાહી થઈ આવવા રખાવી લેવા વિનંતી સહ.

ઓ. એસ.
(લાઈટ)

ડ.એચ.ઓ.ડી.
(લાઈટ)

એડી. ચીફ અન્જલીયર
(સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ)

પ્રતિ,
ડે.મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી,
લાઈટ ખાતું,

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડિસ્કલોજર (વર્ષ
૨૦૨૧-૨૨) ની માહિતી બાબત....

શ્રીમાન,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ) ખાતાની વર્ષ
૨૦૨૧-૨૨ માટે જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર
કરવામાં આવેલ છે જે આ સાથે સામેલ છે, તો સદરહું માહિતી પ્રોએક્ટીવ ડિસ્કલોજર તરીકે સંસ્થાની
વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવાની હોઈ આપ સાહેબશ્રીની મંજૂરી થઈ આવવા વિનંતી છે.

ઓ. એસ.
(લાઈટ)

ડે.એચ.ઓ.ડી.
(લાઈટ)

એડી. ચીફ એન્જનીયર
(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)

ડે. મ્યુનિ. કમિશનર
(લાઈટ)